


નાણાંકીય રોજનીશી



ભારતીય રિઝર્વ બેંક

ગ્રામીણ આયોજન અને ઋણ વિભાગ

કેન્દ્રીય કાર્યાલય, મુંબઈ

જાન્યુઆરી ૨૦૧૩



ભારતીય રિઝર્વ બેંક

આ રોજનીશી નાણાંકીય સાક્ષરતા કેન્દ્રો અને દેશભરની ગ્રામીણ શાખાઓ દ્વારા માસિક અંતરાલે યોજવામાં આવતી નાણાંકીય સાક્ષરતા શિબિરોમાં વિતરણ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક, ગ્રામીણ આયોજન અને ઋણ વિભાગ, કેન્દ્રીય કાર્યાલય મુંબઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ નાણાંકીય રોજનીશી બેંકની વેબસાઈટ www.rbi.org.in પર પણ ઉપલબ્ધ છે.

લેખક : સુષમા વીજ અને ગીતા નાયર
ચિત્રકાર : આર એન રાહટે

ગુજરાતી અનુવાદની ચકાસણી : ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ.

પ્રથમ આવૃત્તિ-જાન્યુઆરી ૨૦૧૩

પ્રકાશક

ભારતીય રિઝર્વ બેંક

ગ્રામીણ આયોજન અને ઋણ વિભાગ
૧૦મો માળ, કેન્દ્રીય કાર્યાલય ભવન,
શહીદ ભગતસિંહ માર્ગ,
ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.

કોપીરાઈટ

માત્ર સ્રોતનો ઉલ્લેખ કરી પુનઃમુદ્રણ કરી શકાય છે.

વ્યક્તિગત માહિતી

પૂરું નામ

સરનામું

શહેર/જિલ્લો

પીનકોડ

રહેઠાણનો ટેલિફોન નંબર

મોબાઇલ

બચત ખાતાની વિગતો :

ખાતું ખોલાવ્યાની તારીખ

બેંક

શાખા

બેંક પ્રતિનિધિનું નામ

પ્રાપ્ત કરેલ સુવિધાઓ : (✓ - ખરાની નિશાની કરો)

- રિકર્ડીંગ ડિપોઝીટ, ફિક્સ્ડ ડિપોઝીટ ☐
- ઓવરડ્રાફ્ટ, કેસીસી, જીસીસી ☐
- રેમિટન્સ, ઇબીટી ☐
- માઇક્રો પેન્શન ☐
- અન્ય ☐

વર્ષ ૨૦૧૩નું કેલેન્ડર

જાન્યુઆરી ૨૦૧૩

ਰਵਿ	ਸੋਮ	ਮੰਗਲ	ਬੁਧ	ਗੁਰੂ	ਸ਼ੁਕਰ	ਸ਼ਨਿ
		੧	੨	੩	੪	੫
੬	੭	੮	੯	੧੦	੧੧	੧੨
੧੩	੧੪	੧੫	੧੬	੧੭	੧੮	੧੯
੨੦	੨੧	੨੨	੨੩	੨੪	੨੫	੨੬
੨੭	੨੮	੨੯	੩੦	੩੧		

ફેબ્રુઆરી ૨૦૧૩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
					૧	૨
૩	૪	૫	૬	૭	૮	૯
૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬
૧૭	૧૮	૧૯	૨૦	૨૧	૨૨	૨૩
૨૪	૨૫	૨૬	૨૭	૨૮		

માર્ચ ૨૦૧૩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
૩૧					૧	૨
૩	૪	૫	૬	૭	૮	૯
૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬
૧૭	૧૮	૧૯	૨૦	૨૧	૨૨	૨૩
૨૪	૨૫	૨૬	૨૭	૨૮	૨૯	૩૦

એપ્રિલ ૨૦૧૩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
	૧	૨	૩	૪	૫	૬
૭	૮	૯	૧૦	૧૧	૧૨	૧૩
૧૪	૧૫	૧૬	૧૭	૧૮	૧૯	૨૦
૨૧	૨૨	૨૩	૨૪	૨૫	૨૬	૨૭
૨૮	૨૯	૩૦				

મે ૨૦૧૩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
			૧	૨	૩	૪
૫	૬	૭	૮	૯	૧૦	૧૧
૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮
૧૯	૨૦	૨૧	૨૨	૨૩	૨૪	૨૫
૨૬	૨૭	૨૮	૨૯	૩૦	૩૧	

୨୦୧୩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
૩૦						૧
૨	૩	૪	૫	૬	૭	૮
૯	૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫
૧૬	૧૭	૧૮	૧૯	૨૦	૨૧	૨૨
૨૩	૨૪	૨૫	૨૬	૨૭	૨૮	૨૯

જુલાઈ ૨૦૧૩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
	૧	૨	૩	૪	૫	૬
૭	૮	૯	૧૦	૧૧	૧૨	૧૩
૧૪	૧૫	૧૬	૧૭	૧૮	૧૯	૨૦
૨૧	૨૨	૨૩	૨૪	૨૫	૨૬	૨૭
૨૮	૨૯	૩૦	૩૧			

ઓગસ્ટ ૨૦૧૩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
				૧	૨	૩
૪	૫	૬	૭	૮	૯	૧૦
૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭
૧૮	૧૯	૨૦	૨૧	૨૨	૨૩	૨૪
૨૫	૨૬	૨૭	૨૮	૨૯	૩૦	૩૧

ਸਪਟੇਮਬਰ ੨੦੧੩

ਰਹਿ	ਸੋਮ	ਮੰਗਲ	ਬੁਧ	ਗੁਰ	ਸ਼ੁਕ	ਸ਼ਨਿ
੧	੨	੩	੪	੫	੬	੭
੮	੯	੧੦	੧੧	੧੨	੧੩	੧੪
੧੫	੧੬	੧੭	੧੮	੧੯	੨੦	੨੧
੨੨	੨੩	੨੪	੨੫	੨੬	੨੭	੨੮
੨੯	੩੦					

ઓક્ટોબર ૨૦૧૩

રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
		૧	૨	૩	૪	૫
૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨
૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮	૧૯
૨૦	૨૧	૨૨	૨૩	૨૪	૨૫	૨૬
૨૭	૨૮	૨૯	૩૦	૩૧		

નવેમ્બર ૨૦૧૩


રવિ	સોમ	મંગળ	બુધ	ગુરુ	શુક્ર	શનિ
					૧	૨
૩	૪	૫	૬	૭	૮	૯
૧૦	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬
૧૭	૧૮	૧૯	૨૦	૨૧	૨૨	૨૩
૨૪	૨૫	૨૬	૨૭	૨૮	૨૯	૩૦

डिसेम्बर २०१३

ਰਹਿ	ਸੋਮ	ਮੰਗਲ	ਬੁਧ	ਗੁਰੂ	ਸ਼ੁਕਰ	ਸ਼ਨਿ
੧	੨	੩	੪	੫	੬	੭
੮	੯	੧੦	੧੧	੧੨	੧੩	੧੪
੧੫	੧੬	੧੭	੧੮	੧੯	੨੦	੨੧
੨੨	੨੩	੨੪	੨੫	੨੬	੨੭	੨੮
੨੯	੩੦	੩੧				

પરિવારના સભ્યોની વિગત

ક્રમ	નામ	ઉંમર	સંબંધ	વ્યવસાય	માસિક આવક
૧.					
૨.					
૩.					
૪.					
૫.					
૬.					
૭.					
૮.					
૯.					
૧૦.					



નાણાંકીય આયોજનનો સંગ્રાથ,
લક્ષ્યની સિદ્ધિ, આપણે હાથ

તમારા લક્ષ્યાંકો નક્કી કરો

ક્રમ		જરૂરિયાત	જરૂરી રકમ	ક્યારે?	દિવસો	જરૂરી દૈનિક ખર્ચ
૧.		સાયકલ	₹ ૧૫૦૦	૩ મહિના	$30 \times 3 = ૯૦$	$₹ ૧૫૦૦ / ૯૦ = ₹ ૧૭$
૨.		સિવવાનો સંચો	₹ ૫૦૦૦	૫ મહિના	$30 \times ૫ = ૧૫૦$	$₹ ૫૦૦૦ / ૧૫૦ = ₹ ૩૩$
૩.		ખેતીના ઓજારો	₹ ૩૬૦૦	૬ મહિના	$30 \times ૬ = ૧૮૦$	$₹ ૩૬૦૦ / ૧૮૦ = ₹ ૨૦$
૪.		પશુધન/ ઢોરઢાંખર	₹ ૧૦૦૦૦	૧ વર્ષ	$3૬૫ \times ૧ = ૩૬૫$	$₹ ૧૦૦૦૦ / ૩૬૫ = ₹ ૨૭$
૫.		નાની દુકાન	₹ ૨૦૦૦૦	૨ વર્ષ	$3૬૫ \times ૨ = ૭૩૦$	$₹ ૨૦૦૦૦ / ૭૩૦ = ₹ ૨૭$
૬.		ઉચ્ચ શિક્ષણ	₹ ૫૦૦૦૦	૫ વર્ષ	$3૬૫ \times ૫ = ૧૮૨૫$	$₹ ૫૦૦૦૦ / ૧૮૨૫ = ₹ ૨૭$
૭.		દીકરીનાં લગ્ન	₹ ૮૦૦૦૦	૧૦ વર્ષ	$3૬૫ \times ૧૦ = ૩૬૫૦$	$₹ ૮૦૦૦૦ / ૩૬૫૦ = ₹ ૨૨$
૮.		પોતાનું ઘર	₹ ૧૦૦૦૦૦	૧૫ વર્ષ	$3૬૫ \times ૧૫ = ૫૪૭૫$	$₹ ૧૦૦૦૦૦ / ૫૪૭૫ = ₹ ૧૮$
૯.		ઘડપણમાં આર્થિક સુરક્ષા	₹ ૩૦૦૦૦૦	૨૫ વર્ષ	$3૬૫ \times ૨૫ = ૯૧૨૫$	$₹ ૩૦૦૦૦૦ / ૯૧૨૫ = ₹ ૩૩$
૧૦.						
૧૧.						
૧૨.						
૧૩.						
૧૪.						
૧૫.						
કુલ કેટલી દૈનિક ખર્ચ						₹ ૨૨૪



તમારા ખર્ચને સમજો




માસિક સારાંશ

આવક : મહિનો-૧

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૧

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



સોડ તાણો એટલી, ચાદર હોય તેટલી

માસિક સારાંશ

આવક : મહિનો-૨

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૨

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



બિનજરૂરી ખર્ચા રોકો,
પૈસા બચાવો, બેંકમાં રોકો


માસિક સારાંશ

આવક : મહિનો-૩

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૩

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



દારૂ



જુગાર




તમાકુ



ઉલ્સવો



તીર્થયાત્રા



મોજશોખની વસ્તુઓ



ઘર



શિક્ષણ



અમળ-વસ્ત્ર



જરૂરિયાતો મર્યાદિત છે - ખર્ચ કરો

ઈચ્છાઓ અમર્યાદિત છે - ઘટાડો

કુટેવો જોખમી છે - દૂર રહો

સમજીવિચારીને ખર્ચ કરો


માસિક સારાંશ

આવક : મહિનો-૪

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૪

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



તમારાં પોતાનાં જ નાણાં વાપરો



શિક્ષણ



વેપાર

ખર્ચ જેટલો ઓછો,
ખચત તેટલી વધુ

માસિક સારાંશ

આવક : મહિનો-૫

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૫

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



પરસેવાની કમાણી કદી ન ગુમાવશો,
સદાય જો બેંકમાં તે જમા કરાવશો


માસિક સારાંશ

આવક : મહિનો-૬

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૬

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



બચત ખાતું ખોલાવશો જો એક,
બેંકની મળશે સેવાઓ અનેક

માસિક સારાંશ

આવક : મહિનો-૭

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૭

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



બીસી આપે છે બેંકની સેવા,
હવે ઘરઆંગણે આવશે તે દેવા

માસિક સારાંશ

આવક : મહિનો-૮

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૮

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



રાખજો દેવાંને વશ
નહિતર તે કરશે વિવશ

માસિક સારાંશ

આવક : મહિનો-૯

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૯

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



ઉધાર લેવા તો જ લંબાવો હાથ,
મળે કામ, ને વધે આવક પણ સાથ

માસિક સારાંશ

આવક : મહિનો-૧૦

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૧૦

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							

શાહુકાર



બેંક



બેંક પાસેથી કરજ લેવાનો ફાયદો,
ઓછું વ્યાજ, ચોખ્ખા હિસાબનો વાયદો


માસિક સારાંશ

આવક : મહિનો-૧૧

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૧૧

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							



જરૂરિયાતો છે અનેક,
બેંક પૂરી કરે દરેક

માસિક સારાંશ

આવક : મહિનો-૧૨

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.	પોતે						
ii.	પતિ/પત્ની						
iii.							
iv.							
૧. કુલ આવક							
૨. લીધેલી લોન							
૩. કુલ આવક = ૧+૨							

ખર્ચ : મહિનો-૧૨

ક્રમ	સ્રોત/સભ્ય	સપ્તાહ-૧	સપ્તાહ-૨	સપ્તાહ-૩	સપ્તાહ-૪	સપ્તાહ-૫	કુલ
i.							
ii.							
iii.							
iv.							
v.							
vi.							
vii.							
૪. કુલ ખર્ચ							
૫. ચૂકવેલ લોન							
૬. કુલ ખર્ચ = ૪+૫							
વધેલી રકમ = ૩-૬							
ઘટ = ૬-૩							

વાર્ષિક સારાંશ

મહિનો	આવક	ખર્ચ	રકમ જમા	રકમ ઘટ
૧.				
૨.				
૩.				
૪.				
૫.				
૬.				
૭.				
૮.				
૯.				
૧૦.				
૧૧.				
૧૨.				
કુલ				

[illegible]

This image shows a blank sheet of lined paper, likely from a notebook or a worksheet. The paper has a light cream or off-white background. At the top, there is a horizontal green band containing the word "નોંધ" (Notice) in black Gujarati script. Below this band, the page is filled with horizontal blue lines for writing. The entire page is framed by a thick orange border. In the bottom-left corner, there is a small decorative graphic featuring stylized green leaves and a yellow flower-like shape.



ભારતીય રિઝર્વ બેંક

અસ્વીકૃતિ :

ભારતીય રિઝર્વ બેંકની નાણાંકીય સમાવેશન માટેની પહેલનો ઉદ્દેશ સામાન્ય માણસને માહિતી અને માર્ગદર્શન આપવાનો જ છે. આ પ્રકાશનમાં આપવામાં આવેલ બેંકિંગ વિશેના વિચારો લોકો સહેલાઈથી સમજી શકે તે માટે જ છે, અને તે કાયદાકીય અને ટેકનીકલ સમજૂતી આપતા નથી. આ માહિતીનો ઉપયોગ કરનારે પોતાની સહજ કાળજી અને વિવેક અનુસાર તેનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકાશનમાં ભૂલો ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવેલ છે. આમ છતાં, જો કોઈ ભૂલ-ચૂક અથવા વિસંગતતા ધ્યાનમાં આવે તો તેમાં દર્શાવેલ સરનામા પર જાણ કરવી, જેથી પછીની આવૃત્તિમાં આ ભૂલો સુધારી શકાય.

આ સાથે જાહેર કરવામાં આવે છે કે આ પ્રકાશનના ઉપયોગથી જો કોઈ પ્રકારનું નુકસાન થાય અથવા કોઈ પ્રકારની હાનિ થાય તો તે માટે પ્રકાશક જવાબદાર રહેશે નહીં.

બેંકમાંથી મેળવો સહાય, ગરીબીને આપો વિદાય



ભારતીય રિઝર્વ બેંક